



ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

કઠો માળ, ગિફ્ટ વન, રોડ પ-સી, ઝોન -પ, ગિફ્ટસીટી,
ગાંધીનગર, -૩૮૨૩૫૫, ગુજરાત, ૦૭૯-૨૩૬૦૨૦૦૦, ફેક્સ : ૦૭૯-
૨૩૬૦૨૦૫૪-૫૫, ઈ-મેઇલ- gerc@gercin.org, Web-site :
www.gercin.org

“બિન ઉપયોગી વાહન-સેવરોલેટ ઓપટ્રાની જાહેર હરાજી થી વેચાણ”

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ, ગાંધીનગર દ્વારા તેની માલિકીના વાહન-સેવરોલેટ ઓપટ્રાની જાહેર હરાજી થી વેચાણ કરવાની છે, જેમાંથી ગાડી નં. જીજે-૧-જી-૪૪૭૧ હાલ ગાંધીનગર ખાતે જે તે હાલત માં રાખવામાં આવેલ છે અને તે જ હાલત માં જાહેર હરાજી થી વેચવાની છે. જાહેર હરાજી ને લગતી માહિતી નિયમો તથા શરતો કચેરીની વેબસાઇટ www.gercin.org ઉપર મુકવામાં આવેલ છે, હરાજી માં ભાગ લેવા માટે રસ ધરાવતી વ્યક્તિઓ એ વાહનની ડિપોઝિટની રકમ ડિમાન્ડ ડ્રાફ્ટ/NEFT થી ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન, ગાંધીનગરના નામ થી તા.:૩૦/૦૩/૨૦૨૧ સુધીમાં ચુકવવાની રહેશે. ડિપોઝિટની રકમ જમા કરાવ્યા વગરની કોઇપણ વ્યક્તિ હરાજી માં ભાગ લઇ શકશે નહિ. જાહેર હરાજી તા.:૦૬/૦૪/૨૦૨૧, સવારે ૧૧:૩૦ વાગે ગાંધીનગર સ્થિત કચેરી ખાતે રાખવામાં આવેલ છે. હરાજી મંજૂર કરવાની આખરી સત્તા નિયામકશ્રી (વહીવટ અને હિસાબ) ને અબાધિત રહેશે.

વાહન નંબર	અપસેટ કિંમત રૂ.	મોડેલ	ડિપોઝિટ
જીજે-૧-જી-૪૪૭૧	૪૦૦૦૦	સેવરોલેટ ઓપટ્રા-૨૦૦૬	૬૦૦૦

અપસેટ કિંમતથી નીચે કિંમત સ્વીકારવા માં આવશે નહીં. વાહનો કચેરીના સમય દરમિયાન ગાંધીનગર ગિફ્ટ સીટી ખાતે જોવા મળશે.

તા.:૧૩/૦૩/૨૦૨૧

ગુજરાત વિદ્યુત નિયંત્રક આયોગ

ક-ઠો માળ, ગિફ્ટ વન, રોડ પ-સી, ઝોન -પ, ગિફ્ટસીટી, ગાંધીનગર, -૩૮૨૩૫૫, ગુજરાત,
૦૭૯-૨૩૬૦૨૦૦૦, ફેક્સ : ૦૭૯-૨૩૬૦૨૦૫૪-૫૫, ઈ-મેઇલ- gerc@gercin.org, Web-site : www.gercin.org

સેવરોલેટ ઓપટ્ટા ગાડી નં. જીજી-૧-જી-૪૪૭૧ની હરાજી ના નિયમો અને શરતો

- સેવરોલેટ ઓપટ્ટા ગાડી નં. જીજી-૧-જી-૪૪૭૧ ની હરાજી ગિફ્ટસીટી, ગાંધીનગર ખાતે તા.:૦૬.૦૪.૨૦૨૧ સમય ૧૧.૩૦ સવારે વાગે રાખવામાં આવેલ છે.
- હરાજી માં ભાગ લેનાર ઇસમે/પાર્ટીએ પોતાનું પુરું નામ/પુરું સરનામું મોબાઇલ નંબર, આધાર કાર્ડની નકલ લેખીતમાં પુરાવા સહિત આપવાનું રહેશે.
- રસ ધરાવતી ઇસમે/પાર્ટીએ વાહન વેચાણની ડિપોઝિટ નીચે દર્શાવેલ કોઠા મુજબ તા.:૩૦/૦૩/૨૦૨૧ સુધીમાં કચેરી સમય દરમિયાન ભરવાની રહેશે.

વાહન નંબર	અપસેટ કિંમત રૂ.	મોડેલ	ડિપોઝિટ
જીજી-૧-જી-૪૪૭૧	૪૦૦૦૦	સેવરોલેટ ઓપટ્ટા-૨૦૦૬	૬૦૦૦

રાષ્ટ્રીયકૃત બેંક નો ડિમાન્ડ ડ્રાફ્ટ/NEFT : ગુજરાત ઇલેક્ટ્રીસીટી રેગ્યુલેટરી કમિશન, ગાંધીનગરના નામથી ચુકવવાના રહેશે. આ રકમ ભરપાઈ કરેલ હશે તે જ હરાજી માં ભાગ લઈ શકશે. લાગતા વળગતાની ડિપોઝિટની રકમ પરત કરવામાં આવશે. **(Bank Details: Gujarat Electricity Regulatory Commission, Saving Account No.:70102150000041, IFSC Code: CNRB0017083 Canara Bank, Gift City, Gift One, Gandhinagar, MICR Code :380015075.)**

- વાહનની હરાજી હાલ જેમ છે તે સ્થિતિમાં જ કરવામાં આવશે. આ અંગે કોઈ વાંધા/દાવો માન્ય રાખવામાં આવશે નહિં. જે રકમની ઓફર મંજૂર થાય તેમણે હુકમની તારીખથી દિન-૭ માં વાહન જે સ્થિતિમાં હશે તે જ સ્થિતિમાં જે તે સ્થળે થી વાહન ખરીદનાર ના ખર્ચે અને જોખમે લઈ જવાનું રહેશે.
- એકવાર હરાજી નો ભાવ નક્કી થયા પછી, સૌથી વધુ રકમ પ્રમાણે હરાજી મંજૂર થઈ ગયા બાદ તે રકમમાં ફેરફાર થઈ શકશે નહિ, તેવા સંજોગોમાં ડિપોઝિટ ની રકમ પરત કરવામાં આવશે નહિ.
- વાહનોની પુરેપુરી રકમ અત્રેની કચેરીની હિસાબી શાખામાં જમા થયા બાદ જ અસલ રજીસ્ટ્રેશન બૂકમાં વાહન માલિકીનું નામફેર કરવા યોગ્ય કાર્યવાહી માટેના આરટીઓમાં રજૂ કરવા અંગેના જરૂરી પેપર્સ સક્ષમ અધિકારીની મંજૂરી મળ્યા બાદ સર્હિ સિક્કા/મત્તા કરી આપવામાં આવશે. આરટીઓની કાર્યવાહી પૂરી થયા પછી વાહનનો કબજો સોંપવામાં આપવામાં આવશે. આ ઉપરાંત વાહન ખરીદનારે વાહનનો લાઇફટાઇમ ટેક્સ, નામ ટ્રાન્સફર ફી, વાહન વીમો આ સિવાય અન્ય લાગુ પડતા કર ભરવાની સઘળી જવાબદારી ખરીદનારની રહેશે.
- અસાધારણ/અનિવાર્ય સંજોગોમાં હરાજી મંજૂર કરવાની કે નામંજૂર કરવાની સત્તા નિયામકશ્રી (વહીવટ અને હિસાબ)ની રહેશે.

૮. નક્કી કરવામાં આવેલ અપસેટ કિંમત કરતાં ઓછી કિંમતના ભાવપત્રક બિલકુલ લક્ષ માં લેવામાં આવશે નહીં, તે આપોઆપ રદ થયેલ ગણાશે.
૯. જાહેર હરાજી/ અગર ઓફર થી જેના ભાવો સૌથી વધુ હશે તેઓએ તરત જ સ્થળ ઉપર રૂપ ટકા રકમ હરાજી ના દિવસે જમા કરાવવાની રહેશે. બાકીની રકમ હરાજી મંજૂર થયેથી દિન-૭ માં ભરવાની રહેશે. સદર રકમ નક્કી કરેલ સમય મર્યાદામાં ભરપાઇ ન થયે તમામ રકમ જપ્ત કરવામાં આવશે. જે પાર્ટી/ઇસમ નાં ભાવ સ્વીકારવા પાત્ર બનેલ ન હોય, તેઓએ ડિપોઝિટની રકમ તુરત જ ચેકથી પરત મેળવી લેવાની રહેશે.
૧૦. હરાજી માં રાખેલ વાહનો ની ડિલિવરી લેતી વખતે સરકારી, અન્ય માલ મિલકતને નુકસાન થશે તો તે અંગે ખરીદનાર ઇસમ જવાબદાર રહેશે. નુકસાન થયેલ અંદાજીત ખર્ચની રકમ જે તે ખરીદનાર ઇસમે સંબંધિત અધિકારીશ્રીને રોકડે થી ચુકવવાના રહેશે.

Sd/-
નિયામક (વહીવટ અને હિસાબ)
ગુજરાત ઇલેક્ટ્રીસિટી રેગ્યુલેટરી કમિશન,
ગાંધીનગર.